

B.A. Semester - 2 (CBCS) Examination
March/April - 2024 (As Per Syllabus Year-2016)
ECONOMICS : P3 PRINCIPLES OF ECO-2 (ELECTIVE-2)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧	સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના ખ્યાલો ઉદાહરણ અને આકૃતિની મદદથી સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૧	સાધનના મૂલ્યનિર્ધારણનો પ્રશ્ન શા માટે અલગ રીતે વિચારવામાં આવે છે?	
પ્રશ્ન.૨	સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના આંતરસંબંધો આકૃતિ દ્વારા સ્પષ્ટ કરો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૨	પેઢી વિકાસના લાભોની ચર્ચા કરો.	
પ્રશ્ન.૩	ઘટતા મળતરનો નિયમ સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૩	ભાડાનો આધુનિક સિધ્ધાંત સમજાવો.	
પ્રશ્ન.૪	“નફો જોખમ વહોરવાનું નહિ. પરંતુ અનિશ્ચિતતા વહોરવાનું વળતર છે.” – ચર્ચા કરો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૪	“નફો નવપ્રવર્તનનું પરિણામ છે.” – ચર્ચા કરો.	
પ્રશ્ન.૫	ટૂંકનોંધ લખો. (કોઇપણ બે)	(૧૪)
	1) વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ 3) આભાસી ભાડું	
	2) ઉદ્યોગ વિકાસના લાભો 4) ઘટતા મળતરના નિયમની ઉપયોગિતા	

ENGLISH VERSION

Que.1	Explain the concept of fixed cost and variable cost with the help of illustration and figure.	(14)
	OR	
Que.1	Why does the issue of price determination of factors of production are separately thought?	
Que.2	Clarify the interrelationships between average cost and marginal cost with the help by diagram.	(14)
	OR	
Que.2	Discuss the advantages of expansions size of firm.	
Que.3	Explain the law of diminishing return.	(14)
	OR	
Que.3	Explain the modern theory of rent.	
Que.4	“profit is not reward for bearing of risks but reward for bearing of uncertainty.”- discuss.	(14)
	OR	
Que.4	“profit is a result of innovation” – discuss.	
Que.5	Write a short note. (any two)	(14)
	1) The concept of alternative cost.	
	2) The advantage of expansion size of industry.	
	3) Quasi rent.	
	4) Usefulness of the law of diminishing return.	
